



December 11, 2019

To,
The Manager
Dept. of Corporate Services
Bombay Stock Exchange Ltd.
25th Floor, P.J. Towers,
Dalal Street,
Mumbai - 400001

Sub: Advertisement in Newspapers under Regulation 47 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015.

Ref: Shahlon Silk Industries Ltd. (BSE Script Code: 542862)

Dear Sir,

With regard to subject, we attached herewith Newspaper Cutting for the advertisement published in 'Gujarat Guardian' and 'The Financial Express' publication dated 16/11/2019 in the matter of **Publication of Unaudited Financial Results** for the quarter and half year ended on 30/09/2019.

Kindly update this information on your website for investors/general public.

Thanking you.

For, Shahlon Silk Industries Limited

A handwritten signature in blue ink, appearing to read 'Hitesh K. Garmora', enclosed in a blue circular stamp.

Hitesh K. Garmora
Company Secretary

Welspun Specialty Solutions Limited

(Erstwhile RMG Alloy Steel Limited)
 Regd. Office : Plot No. 1, GIDC Industrial Estate, Jhagadia, Dist. Bharuch, Gujarat-393110
 Website : www.rmgalloysteel.com, Email ID : allcompanysecretaryofrmgl@welspun.com
 CIN : L27100GJ1989PLC020359

SATURDAY, NOVEMBER 16, 2019

29

SHAHLON SILK INDUSTRIES LTD

Corporate Office: 3rd Floor, Dawer Chambers, Nr. Sub Jail, Ring Road, SURAT 395002.
 CIN: U17120GJ2008PLC053464

Tel no.: +91-261-4190200 Fax No.: +912635550 Website: www.shahlon.com

Extract of Standalone Unaudited Financial Results for the Quarter and Half year ended
 30th September 2019 (₹ In Lacs)

| Sr. No. | Particulars | Quarter ended (Unaudited) | | Half Year ended (Unaudited) | | Year ended (Audited) |
|---------|--|---------------------------|----------|-----------------------------|----------|----------------------|
| | | 30.09.19 | 30.09.18 | 30.09.19 | 30.09.18 | 31.03.19 |
| 1 | Total Income from operations (net) | 8914.51 | 14986.59 | 18677.50 | 25461.81 | 53206.14 |
| 2 | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items) | 202.27 | 200.50 | 512.05 | 310.64 | 488.86 |
| 3 | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items#) | 202.27 | 200.50 | 512.05 | 310.64 | 488.86 |
| 4 | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items) | 181.60 | 120.93 | 404.25 | 203.57 | 372.99 |
| 5 | Total comprehensive Income for the period (comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)) | 161.60 | 120.93 | 404.25 | 203.57 | 392.34 |
| 6 | Equity Share Capital (Face Value Rs.10/- per share) | 1788.05 | 1115.23 | 1788.05 | 1115.23 | 1115.23 |
| 7 | Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year) | | | | | 7296.87 |
| 8 | Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) | | | | | |
| | Basic: | 0.91 | 1.09 | 2.26 | 1.93 | 3.34 |
| | Diluted: | 0.91 | 1.00 | 2.26 | 1.93 | 2.09 |

Notes:

- The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 14th Nov, 2019.
- The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Half Year ended 30th September, 2019, filed with the stock Exchanges under Regulations 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Financial Results is available on the Stock Exchange website (www.bseindia.com) and on Company's website (www.shahlon.com)

For Shahlon Silk Industries Ltd.
 By Order of the Board
 Director

Date : 14-11-19
 Place : Surat.



Laxmi Road Branch : 592, Sadashiv Peth,
 Laxmi Road, Pune-411030 Fax : 020-24458445
 Ph : 020-24488582, 24453495
 Email : LaxmiRoad.Pune@bankofindia.co.in

POSSESSION NOTICE

Whereas, the undersigned being the Authorised Officer of the Bank of India, Laxmi Road Branch under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 03/09/2019 calling upon the Borrower Shri Paresht Nitin Patil and Shri Nitin Sham Patil to repay the amount mentioned in the notice being Rs. 54,06,845.32 (Rupees Fifty Four Lacs Six Thousand Eight Hundred Forty Five and Paise Thirty Two) within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the security Interest Enforcement Rules, 2002 on this 13/11/2019.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of India for an amount of Rs. 54,06,845.32 and Interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property

All that part and parcel of the property consisting of Flat No.803, 8th floor, P Wing, Sun Universe, Mouje Narhe, Pune.

Date : 13/11/2019
 Place : Pune

Authorised Officer,
 Bank of India



State Bank of India, Retail Asset Central Processing Centre - IV: 1st & 2nd Floor, Lalwani Icon, S. No-323/1+2, Plot No.93+94,
 Tel: 020-24458445, Email: rccn4.pune@sbi.co.in